https://archive.org/details/bk1372/page/n0/mode/1up

2012-12 -Vishv Hindu Samachar (1372)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

અંક-૧૨, વર્ષ-૪૩, ડિસેમ્બર-૨૦૧૨, સંવત-૨૦૬૮, યુગાબ્દ-૫૧૧૪, કિંમત-રૂા. ૧૦-૦૦

વિશ્વહિન્દુ સમાચાર

શ્રધ્ધાંજલિ આપવા હિન્દુ ફાઈટર બનીએ

આસામ દંગા પીડિતની સેવામાં વિશ્વ હિન્દુ પરિષદ



પ્રેરણાપીઠ - દશાબ્દી મહોત્સવ સંપન્ન

પૂ. નાનકદાસજીની રજતતુલા યોજાઈ

realpatidar.com

https://archive.org/details/bk1372/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 4.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1372/page/n2/mode/1up

2012-12 -Vishv Hindu Samachar (1372)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:46:04 +05'30'

realpatidar.com

અંક-૧૨, વર્ષ-૪૩, ડિસેમ્બર-૨૦૧૨, સંવત-૨૦૬૮, યુગાબ્દ-૫૧૧૪, કિંમત-રૂા. ૧૦-૦૦

વિશ્વહિન્દુ સમાચાર



શ્રધ્ધાંજલિ આપવા હિન્દુ ફાઈટર બનીએ

આસામ દંગા પીડિતની સેવામાં વિશ્વ હિન્દુ પરિષદ



પ્રેરણાપીઠ - દશાબ્દી મહોત્સવ સંપન્ન
પૂ. નાનકદાસજીની રજતતુલા યોજાઈ

realpatidar.com

https://archive.org/details/bk1372/page/n3/mode/1up

2012-12 -Vishv Hindu Samachar (1372)

https://archive.org/details/bk1372/page/n4/mode/1up

ડિસેમ્બર - ૨૦૧૨

વિશ્વ હિન્દુ સમાચાર

(માસિક)

વર્ષ ૪૩ અંક - ૧૨

આદ્ય તંત્રી
મ.મ.પ્રા. સ્વ. શ્રી કે.કા.શાસ્ત્રી
વિદ્યાવાચસ્પતિ

મુદ્રક અને પ્રકાશક
શ્રી રાજેશભાઈ ડી. શાસ્ત્રી

તંત્રી-સંપાદક
ડૉ. કૌશિક મહેતા
વિદ્યાવાચસ્પતિ

સંપાદક મંડળ
શ્રી મહેન્દ્રભાઈ સંઘપાલ (સહસંપાદક)
શ્રી શકુંતલાબેન રાજપુત
શ્રી સુલોચનાબેન અધ્વર્યુ

વ્યવસ્થાપક : બાબુભાઈ પ્રજાપતિ
જાહેરાત સરક્યુલેશન : રમેશભાઈ પંડ્યા (મોરબી)
મુખપૃષ્ઠ-કલર પેજ : સ્ટેટસ આઈ. એન. સી.

લવાજમ

વાર્ષિક	રૂા.	૧૦૦/-
શુભેચ્છક	રૂા.	૧૨૫/-
આજીવન	રૂા.	૧,૦૦૦/-
વિદેશનું વાર્ષિક........	રૂા.	૧,૦૦૦/-
વિદેશનું આજીવન	રૂા.	૧૦,૦૦૦/-
છુટક મૂલ્ય.............	રૂા.	૧૦/-

મુદ્રણ સ્થળ
એલાઈડ ઓફસેટ પ્રિન્ટર્સ
૧૪/૨ કાલીદાસ મીલ કમ્પાઉન્ડ ગોમતીપુર,
કર્ણાવતી - ૨૧. ફોન : ૨૨૧૬૫૯૫૦

માલિક
રાષ્ટ્ર ચેતના પ્રકાશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
૧૧, મહાલક્ષ્મી સોસાયટી,
કર્ણાવતી ૩૮૦ ૦૦૭
ફોન - ૨૬૬૫૧૩૬૫, ૨૬૬૦૪૦૧૫

પત્રવ્યવહારનું સરનામું
વિશ્વ હિન્દુ સમાચાર કાર્યાલય ૧૧,
મહાલક્ષ્મી સોસાયટી, મહાલક્ષ્મી ચાર
રસ્તા, પાલડી, કર્ણાવતી ૩૮૦ ૦૦૭.
૬૫૪૩૦૬૫૪

વૈધાનિક સૂચના : વિશ્વ હિન્દુ સમાચારમાં પ્રકાશિત સામગ્રીમાં લેખકોના પોતાના વિચાર છે. સંપાદક તથા પ્રકાશક એ સાથે સહમત હોય તે જરૂરી નથી. વિ.હિ.સમાચારની સંબંધિત બધા જ વાદ-વિવાદ પ્રકાશન તારીખથી ૩ (ત્રણ) માસની અંદર માત્ર અમદાવાદ ન્યાયક્ષેત્રમાં થઈ શકશે.

"બાળાસાહેબ..... પરત યા પરત યા" હિન્દુ ફાઈટર અવશ્ય બનીએ

૧૮ નવેમ્બર સાંજે સૂર્યાસ્તની સાથે સાથે જાણે એક યુગનો અંત આવ્યો હોય તેવો ભાવ સંપૂર્ણ ભારતે અનુભવ્યો. સ્વ. બાળાસાહેબ ઠાકરેના પાર્થિવ શરીરને પંચમહાભૂતમાં વિલીન કરાયો. આઝાદીબાદ આટલી વિશાળ-વિરાટ સ્મશાનયાત્રા કદાચ પ્રથમવાર જોવામાં આવી. અગ્નિસંસ્કાર સમયે ૨ લાખથી વધુ લોકો સ્વયંભૂ હાજર રહે અને ૨૦ લાખ લોકો પાર્થિવ દેહના દર્શન કરે અને સ્વયંભૂ શિસ્તમાં રહે એ હિન્દુસમાજના છૂપાયેલા હિન્દુત્ત્વના વિરાટદર્શન હતા.

કેશવ સીતારામ ઠાકરેના બીજા સુપુત્ર એટલે પ્રબોધનકાર "બાળાઠાકરે". ગળથૂથીમાં જ શિવાજી અને સાવરકરના જેવા હિન્દુસંસ્કાર ઘરમાંથી જ મળ્યા. કાર્ટુનિષ્ટથી કેરિયર શરૂ કરનાર બાળાસાહેબે ૧૯૬૬માં મરાઠી અધિકારો માટે શિવસેના સ્થાપી. જેણે આગળજતાં ૧૯૮૭માં મજબૂતાઈથી હિન્દુત્ત્વનો હાઈવે પકડ્યો. મુંબઈ બહાર બાળાસાહેબ બહુ ઓછું ગયા પણ મુંબઈમાં ક્ષણક્ષણ હિન્દુપૂંજ પ્રગટાવતા રહ્યા જેનો ઉજાસ આખા ભારતમાં ફેલાતો રહેતો.

ભય ફેલાવવાના આક્ષેપો સામે બાળાસાહેબ કહેતા કે "હું રાજકારણમાં બળનો ઉપયોગ વધુને વધુ કરીશ કેમ કે કેટલાક લોકોને હિંસાનો ડર દેખાડવો જરૂરી છે, તો જ તેઓ કંઈક સબક શીખશે." એકવાર તો તેમણે એમ પણ કહેલું કે "હિન્દુઓ હવે માર નહિ ખાય, તે લોકોને હવે આપણે તેમની ભાષામાં જ જવાબ આપવો પડશે." બાળાસાહેબ જે બોલતા તે કરી બતાડતા. બેધડક પોતાનો મત આપવો અને વ્યક્તિગત જીવનથી માંડી જાહેર જીવનના વ્યવહારમાં સદા "પોતાની માન્યતા'નું દર્શન કરાવવું એ એમનું આગવું વ્યક્તિત્ત્વ હતું. આના કારણે જ કહેવાય છે કે દાઉદ કે અન્ડરવર્લ્ડના અનેક ખેરખાંઓ પોલીસથી નહિ પણ બાળાસાહેબથી ગભરાતા !

ગુલામીના ચિહ્નો આઝાદ ભારતમાં ન રહેવા જોઈએ તેવી દેશદાઝ અને તેમણે બોમ્બેનું "મુંબઈ" વી-ટી સ્ટેશનને "શિવાજી ટર્મિનસ" અને ફલોરા ફાઉન્ટેનને "હુતાત્મા ચોક"નું નામાભિધાન કરાવ્યું. બસ, પછીથી કલકત્તા કોલકટા, મદ્રાસ ચૈન્નાઈ, બેંગ્લોર બેગલુર બની ગયા. પોતાને બધા "ઉદારવાદી" કહે તેવા ચાળા એમણે ક્યારેય ન કર્યા. આતંકવાદીઓ તૈયાર કરનાર પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમાય એવી દેશભાવનાની પ્રખર લાગણી સાથે તેમણે વિરોધ કરેલો અને શિવસૈનિકોએ પીચ ખોદી નાંખેલી. આ કૃત્યને દેશભક્તોએ હૃદયથી આવકારેલું.

મુંબઈની મીલો બંધ થતાં હજારો મજૂરોને નોકરી અપાવવાનો સફળ સંઘર્ષ તેમણે કરેલો. એમ કહેવાય છે કે બેકાર લોકો રોજી મળે માટે વડા-પાઉંની શોધ એ બાળાસાહેબની છે.

બાળાસાહેબ ઠાકરેની વર્તન-વાણી એટલા પ્રખર હતા કે તેમના વિરોધીઓ અકળાઈને બોલી ઉઠતા કે બાળાસાહેબ લોકશાહીમાં નહિ પણ ઠોકશાહીમાં માને છે. કોઈની પણ પરવા કર્યા વગર તેમણે હિટલરના જાહેરમાં વખાણ કરેલા.

હિન્દુસમાજે અનુભવ્યું છે કે હિન્દુત્ત્વને કોઈ કોમવાદી કે કટ્ટરવાદી તરીકે ઓળખાવતું ત્યારે બાળાસાહેબની "ટાઈગરત્રાડ" હિન્દુ વિરોધીઓને ચૂપ કરી દેતી. હિન્દુહૃદય સમ્રાટનો ભગવો ઝભ્ભો ઉતારી "વિકાસપુરુષ" બનવાનો ચાળો તેમણે ક્યારેય કર્યો ન હતો. "બાબરી અમે નથી તોડી અમે નથી તોડી" કહેવાતા રામભક્તોની આવી બૂમાબૂમ વચ્ચે ટાઈગરે ત્રાડ નાંખેલી કે "જો શિવસૈનિકોએ તોડી હોય તો મને ગૌરવ છે." બાળાસાહેબે હિન્દુત્ત્વને વ્યવહારિકતામાં સર્વોપરી બનાવવા સતત ચિંતા કરી છે. માટેજ કાર્ટુનિષ્ટમાંથી હિન્દુનિષ્ઠ તરીકે સર્વસ્વીકૃત બન્યા. આમ હિન્દુના હૃદયમાં તેઓ હિન્દુસમ્રાટ તરીકે એવા તો સ્થીર થયા કે તેમની સ્મશાનયાત્રામાં હિન્દુઓ દિલથી પ્રાર્થના કરતા કે "પરત યા પરત યા બાળા સાહેબ પરત યા". હિન્દુ ટાઈગર ભલે ઉપર ગયા પણ લાખ્ખો હિન્દુફાઈટરો મૂક્તા ગયા. કદાચ હિન્દુ ટાઈગર ન બનાવ પણ બાળાસાહેબના માર્ગે ચાલી તેમને શ્રદ્ધાંજલિ આપવા હિન્દુફાઈટર અવશ્ય બનીએ.

ડૉ. કૌશિક મહેતા

realpatidar.com

https://archive.org/details/bk1372/page/n5/mode/1up

Akhil Bharatiya Sant Sammelan at Pirana

realpatidar.com

પ્રેરણાપીઠ - પીરાણા ખાતે યોજાયું અ.ભા.સંત સંમેલન પૂ.નાનકદાસજીની યોજાઈ રજતતુલા

જગદગુરુ સતપંથાચાર્ય પૂ. નાનકદાસજીની યોજાઈ રજતતુલા.

પ.પૂ. જગદ્‌ગુરુ સતપંથાચાર્ય પૂ.શ્રી નાનકદાસજી મહારાજનો ગાદીપતિ તરીકેનો દશાબ્દિ મહોત્સવ પીરાણા પ્રેરણાપીઠ ખાતે યોજાયો. ત્રણ દિવસ ચાલેલા આ મહોત્સવમાં અ.ભા. સંતસમિતિના અધ્યક્ષ સહિત પૂ. શંકરાચાર્યો મહામંડલેશ્વરો, આચાર્યો, વિવિધ અખાડાના અગ્રણી મહાત્માઓ, સંતો, મહંતો એમ કુલ ૨૫૦૦ જેટલા સંતોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે વિ. હિ. પરિષદના આં.રા.કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને હિન્દુત્વ બાબતે વધુને વધુ જાગ્રત થવા તથા સમાજને જાગૃત કરવા આહ્‌વાન કર્યું હતું. ભાષણ અગાઉ ડૉ.

પૂ. સંતોના શ્રી ચરણોમાં વંદન કરી આશીર્વાદ લેતા ડો. પ્રવિણભાઈ ૨૫૦૦ જેટલા સંતોએ ભાગ લીધો હતો.

realpatidar.com

https://archive.org/details/bk1372/page/n6/mode/1up

realpatidar.com

પ્રવીણભાઈએ પૂ. સંતોના શ્રી ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

પૂ. નાનકદાસજી તથા પૂ. અવિચલદાસજીએ ડૉ. પ્રવીણભાઈને શાલ ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

આ શુભ અવસરે જગદગુરુ સતપંથાચાર્યજી પૂ. નાનકદાસજીને ચાંદીથી તોલવામાં આવેલા હતા. આ અવસરે આખા સભામંડપમાં પ્રસન્નતા તથા હર્ષોલ્લાસનું મોજુ ફરી વળ્યું હતું.

સભામંડપમાં વિવિધ સત્રોમાં દેશભરના સંતોએ આશીર્વાદ આપી પ્રેરણાપીઠના વિસ્તાર માટે તથા સતપંથના પ્રસાર માટે આશિષ પ્રવચન આપ્યા હતા.

સતપંથ સંપ્રદાયના ગુજરાત ભરમાંથી અંદાજે એકાદ લાખ લોકોએ આ શુભપ્રસંગમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી.

દિનાંક ૧૭ નવેમ્બરના રોજ રાત્રિ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીના જીવન આધારીત સુંદર નાટક રજૂ કરાયું હતું.

આ અવસરે ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ કાર્યાધ્યક્ષ **ડૉ. કૌશિક મહેતાએ અતિથિપદે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે સનાતનધર્મનું જે દર્શન છે તેજ દર્શન સતપંથનું છે.** માટે તેની ઉપર થતાં કથા કથિત આરોપો પાયાવિહોણા અને જૂઠા છે. વધુમાં ડૉ. કૌશિકભાઈએ જણાવેલ કે હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે બ્રહ્મલીન પૂ. કરસનદાસજી મહારાજે તથા વર્તમાન ગાદીપતિ પૂ. નાનકદાસજી મહારાજે અભિનંદનિય સેવાઓ કરી છે.

આ પ્રસંગે ગુજરાત સંઘના (આર.એસ.એસ.) સંઘચાલકજી ડૉ. જયંતિભાઈ તથા પ્રાંત પ્રચારક મા. શ્રી પ્રવીણ ઓટિયાજી ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.

– અહેવાલ : ચિરાગ અધ્વર્યુ

જગદગુરુ સતપંથાચાર્ય પૂ. નાનકદાસજી મહારાજના આશીર્વાદ લેતા ડૉ. પ્રવીણભાઈ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

વિશ્વ હિન્દુ સમાચાર
VISHWA HINDU SAMACHAR

૩,૦૦,૦૦૦થી વધુ વાચકો વિશ્વ હિન્દુ સમાચારમાં આપનો અવાજ પ્રકાશિત કરો

આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું, સામાજિક સમરસતાનો સંદેશ ફેલાવતું, ત્યાગ અને સમર્પણ દ્વારા ધર્મના દિપને જલતો રાખનાર વ્યક્તિઓની મહાનતા અને નમ્રતાના પાઠ ભણાવતું આ હિન્દુ ગૌરવવંતુ માસિક છે.

વિશ્વ હિન્દુ સમાચાર પ્રકાશિત

જાહેર ખબરના દર

અ. નં.	વિગત	મહિના માટે એક અંકનો દર	૧૨ મહિના માટે વાર્ષિક દર
૧.	આખુ પાનું (અંદરનું)	રૂા. ૮૦૦૦/-	રૂા. ૮૦,૦૦૦/-
૨.	અડધું પાનું (અંદરનું શુભેચ્છક)	રૂા. ૯૦૦૦/-	રૂા. ૯૦,૦૦૦/-
૩.	અડધું પાનું (અંદરનું)	રૂા. ૫૦૦૦/-	રૂા. ૫૦,૦૦૦/-
૪.	અડધું પાનું (અંદરનું શુભેચ્છક)	રૂા. ૬૦૦૦/-	રૂા. ૬૦,૦૦૦/-
૫.	પા. પાનું (અંદરનું)	રૂા. ૨૫૦૦/-	રૂા. ૨૫,૦૦૦/-
૬.	પા. પાનું (અંદરનું શુભેચ્છક)	રૂા. ૩૦૦૦/-	રૂા. ૩૦,૦૦૦/-
૭.	૩ સે.મી. X ૬ સે.મી. (અંદરનું)	રૂા. ૧૦૦૦/-	રૂા. ૧૦,૦૦૦/-
૮.	૩ સે.મી. X ૬ સે.મી. (અંદરનું શુભેચ્છક)	રૂા. ૧૫૦૦/-	રૂા. ૧૫,૦૦૦/-
૯.	ચોથુ ટાઈટલ - ચાર કલર	રૂા. ૨૦,૦૦૦/-	રૂા. ૨,૦૦,૦૦૦/-
૧૦.	ટાઈટલ કવર નં. ૨ - ચાર કલર	રૂા. ૧૫,૦૦૦/-	રૂા. ૧,૫૦,૦૦૦/-
૧૧.	ટાઈટલ કવર નં. ૩ - ચાર કલર	રૂા. ૧૫,૦૦૦/-	રૂા. ૧,૫૦,૦૦૦/-

અંકના પૃષ્ઠનું માપઃ- ૨૦ સે.મી. x ૨૬ સે.મી.
કોલમઃ- અંક પૃષ્ઠ ત્રણ કોલમ
મુદ્રિત વિસ્તારઃ- ૧૭.૫ સે.મી. x ૨૪ સે.મી.

મનીઓર્ડર, ચેક-ડ્રાફ્ટ - વિશ્વ હિન્દુ સમાચારના નામનો મોકલવા વિનંતી

સરકારી અર્ધસરકારી સંસ્થાઓ, જાહેર ખાનગી સાહસો, નાના, મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ વ્યવસાયિકો સૌને આ સત્કાર્યમાં જોડાવા નિમંત્રણ છે. તમે ખર્ચેલા રૂપિયાના પૂરા મૂલ્ય સાથે સાથે ધર્મકાર્યનો પણ આવો બેવડો લાભ આપ જરૂર ઉઠાવશો.

આજે જ સંપર્ક કરો

જાહેરાત આપવા માટેનું સંપર્ક સ્થળ

વ્યવસ્થાપકઃ વિશ્વ હિન્દુ સમાચાર
ડૉ. વણીકર સ્મારક ભવન, ૧૧, મહાલક્ષ્મી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોનઃ ૬૫૪૩૦૬૫૪
બાબુભાઈ પ્રજાપતિ - વ્યવસ્થાપક વિશ્વ હિન્દુ સમાચાર

realpatidar.com

https://archive.org/details/bk1372/page/n8/mode/1up